

UCCC & SPBCBA & SDHGBCA & IT
Internal Exam Syllabus -T.Y B.Com (Semester – VI)
Advanced Accounting and Auditing paper - 7

Unit 1: Company Auditors (45%)

1.1 Introduction

- Appointment of Auditor
- Removal and Remuneration of an Auditor
- Status of Auditor
- Rights of an Auditor
- Duties of Auditor
- Duties under the Companies Act or Duties according to judicial decisions

1.2 Divisible Profit

- Introduction
- What is Profit
- Importance of correct computation of profit
- What is divisible profit
- Difference between profit and divisible profit
- Guiding principles in computing divisible profit
- Dividend
- Debatable points regarding Divisible profit
- Provisions of Companies Act regarding Depreciation

1.3 Auditor not render certain services – Liabilities of an Auditor

- Introduction
- The liabilities of an Auditor of a sole trading or a partnership concern
- Liabilities of an Auditor under the Companies Act
- Liabilities for negligence
- Liabilities for misfeasance
- Criminal Liabilities
- The liability of an auditor to third parties
- Liabilities of different Auditor

Unit 2: Investigation (20%)

- Introduction
- Definition of Investigation

Characteristics of Investigation

Difference between Investigation and Audit

Where fraud is suspected

Where running business is proposed

Unit 3: Preparation of Audit Programming (20%)

Audit Programme

Preparation of Audit Programs.

Preparation of Audit Program for Educational Institution

Preparation of Audit Program for Private Companies

Auditor's Report

Unit 4: Recent Trends in Auditing (15%)

Nature and Significance of Tax Audit

Meaning and Overview of IT enabled Auditing

Advanced Accounting and Auditing paper - 7

Unit 1: કંપની ઓડિટર (૪૫%)

૧.૧ પરિચય

- નિમણૂક

- ઓડિટરને દૂર કરવા, રાજીનામું આપવું અને મહેનતાણું

- ઓડિટરનો દરજ્જો

- ઓડિટર્સની સત્તાઓ અને ફરજો

- કંપની ધારા મુજબ ઓડિટરની ફરજો અને જુડીસીઅલ નિર્ણયો મુજબ ફરજો

૧.૨ વહેંચણીપાત્ર નફો

- પરિચય

- નફો એટલે શું?

- સાચા નફાની ગણતરીનું મહત્વ

- વહેંચણીપાત્ર નફો
- નફો અને વહેંચણીપાત્ર નફો વચ્ચેનો તફાવત
- વહેંચણીપાત્ર નફાની ગણતરીના માર્ગદર્શક સિદ્ધાંતો
- વહેંચણીપાત્ર નફાના વિવાદાસ્પદ મુદ્દાઓ
- ઘસારા અંગેની કંપની ધારાની જોગવાઈઓ

૧.૩ ઓડિટરની નિષેધાત્મક સેવાઓ- ઓડિટરની જવાબદારીઓ

- પરિચય
- એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીના ઓડિટરની જવાબદારીઓ
- કંપની અધિનિયમ હેઠળ ઓડિટરની જવાબદારીઓ
- બેદરકારી (Negligence) માટેની જવાબદારીઓ
- કર્તવ્યભંગ અંગેની જવાબદારી (Misfeasance) માટેની જવાબદારીઓ
- ફોજદારી જવાબદારીઓ (Criminal Liabilities)
- ત્રાહિતપક્ષ પ્રત્યે ઓડિટરની જવાબદારી
- વિવિધ પ્રકારના ઓડિટરની જવાબદારીઓ

Unit 2: અન્વેષણ (૨૦%)

- પરિચય
- અન્વેષણની વ્યાખ્યા
- અન્વેષણની લાક્ષણિકતાઓ
- અન્વેષણ અને ઓડિટ વચ્ચેનો તફાવત

- છેતરપિંડીની શંકા હોય ત્યારે અન્વેષણ
- ધંધો ખરીદનાર વતી અન્વેષણ

Unit 3. ઓડિટ પ્રોગ્રામની તૈયારી (૨૦%)

- ઓડિટ કાર્યક્રમ
- ઓડિટ કાર્યક્રમની તૈયારી
- શૈક્ષણિક સંસ્થાઓ માટે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો
- ખાનગી કંપનીઓ માટે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો
- ઓડિટરનો અહેવાલ

4. ઓડિટિંગમાં તાજેતરના વલણો (15%)

- કરવેરા ઓડિટનું સ્વરૂપ અને મહત્વ
- IT ઈનેબલ ઓડીટનો અર્થ અને સમીક્ષા